


RAN-2408000603030005
S.Y.B.Com. (Sem. -III) Examination November - 2025
MDC : Monetary Economics (Paper - III)
Time: 2 Hours]
[Total Marks: 50
સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book
- (2) જમણી બાજુના અંક પ્રશ્નોના ગુણ દર્શાવે છે.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર.1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો (કોઈ પણ પાંચ)
(10)

1. નાણુ એટલે શું?
2. અવેજ નાણુ એટલે શું? અવેજ નાણા ના ઉદાહરણ આપો.
3. કુગાવો એટલે શું?
4. ડિજિટલ ચુકવણી ની કોઈપણ ચાર પદ્ધતિ જણાવો.
5. બેંક દર એટલે શું?
6. નાણા બજાર માં ઉપયોગમાં લેવાતા શાખી સાધનો જણાવો.
7. મૂડી બજાર એટલે શું?

પ્ર.2. ખર્ચ જન્ય કુગાવો અને માંગ જન્ય કુગાવાની આકૃતિ સહિત સમજૂતી આપો
(14)
અથવા
પ્ર.2. (અ) ફિશર ના સમીકરણની મર્યાદા સમજાવો
(7)
(બ) આધુનિક અર્થતંત્રમાં નાણાના લાભાલાભ ની ચર્ચા કરો.
(7)
પ્ર.3. મધ્યસ્થ બેંકના પરિમાણાત્મક ગુણાત્મક સાધનો સમજાવો
(14)
અથવા
પ્ર.3. (અ) નાણા બજાર અને મૂડીબજાર વચ્ચેનો તફાવત સમજાવો.
(7)
(બ) ભારતીય નાણા બજારની ખામીઓ ચર્ચા.
(7)
પ્ર.4. ટૂંકનોંધ લખો (કોઈ પણ બે)
(12)

1. નાણા ના કાર્યો
2. ફિલિપ્સ વક્ર
3. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ
4. મૂડી બજારના સાધનો

ENGLISH VERSION

- Q.1. Answer the following questions in brief (any five) (10)**
1. What is money?
 2. What is near money? Give illustrations of near money.
 3. What is inflation?
 4. State any of the four methods of digital payments.
 5. What is bank rate?
 6. State the credit instruments dealt within the money market.
 7. What is capital market?
- Q.2. Explain the demand-pull and cost-push inflation with diagram. (14)**
- OR**
- Q.2. (A) Explain the limitations of the Fischer's equation. (07)**
(B) Discuss merits and demerits of money in modern economy. (07)
- Q.3. Explain quantitative and qualitative credit control tools of the central bank. (14)**
- OR**
- Q.3. (A) explain difference between money market and capital market. (07)**
(B) Discuss the defects of Indian money market. (07)
- Q.4. write short notes (any two): (12)**
1. Functions of money.
 2. Phillip's curve.
 3. International monetary fund.
 4. Instruments of capital market.
-